

- 1) ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે જીલ્લાઓ દ્વારા જે ઉમેદવારોના કિસ્સામાં ક્વેરી દર્શાવેલ હતી તે પૈકી જે ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવેલ છે તેની યાદી પત્રક-અ થી મુકેલ છે અને જે ઉમેદવારોના કિસ્સામાં ગુણમાં કે અન્ય કોઈ બાબતે ફેરફાર કરવામાં આવેલ હોય તેની યાદી પત્રક-બ પર મુકેલ છે.
- 2) ઉપલબ્ધ જગ્યાના આધારે વિષયવાર, કેટેગોરીવાઇઝ ઉમેદવારોનું PML-2 આથી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે
- 3) વાંધા અરજીઓ મળ્યા બાદ વાંધા અરજીઓની ચકાસણી કરી ફાઈનલ મેરીટ લીસ્ટ અને વેઈટીંગ લીસ્ટ જાહેર કરવામાં આવશે. સબબ પ્રસિદ્ધ કરવામાં આવેલ PML-2 ફેરફારને આધીન છે.
- 4) PML-2 માં સમાવિષ્ટ થવાથી નોકરી મેળવવા માટેનો ઉમેદવારનો હક્ક પ્રસ્થાપિત થતો નથી.
- 5) સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી સંબંધિત ઉમેદવારો પોતાની વાંધા અરજીઓ તા. 26/10/2020ના રોજ 11.00 કલાક થી તા.3/11/2020 ના રોજ 16.00 કલાક સુધી રજુ કરી શકશે. (દરરોજ 11.00 થી 16.00 કલાક દરમિયાન, જાહેર રજાના દિવસો સિવાય)
- 6) કોઈપણ પ્રકારની રજૂઆત માટે ઉમેદવારોએ પોતે જે જિલ્લામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પસંદગી આપી હોય તે જિલ્લાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેન્દ્ર ખાતે રૂબરૂમાં વાંધા અરજી આપવાની રહેશે. કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગર ખાતે કોઈ પણ ઉમેદવારે રજૂઆત અર્થે આવવું નહીં. તેમ છતાં જો કોઈ ઉમેદવાર રજૂઆત કરવા આવશે તો શિસ્તભંગ ગણી તેવા ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે.
- 7) ઉમેદવારે વાંધા અરજીમાં પોતાનું નામ, વિષય, માધ્યમ, અરજી નંબર અને ટાટ નંબર, મોબાઈલ નંબર અચૂક દર્શાવવાનો રહેશે. વિગતો વગરની વાંધા અરજી દફતરે કરવામાં આવશે.
- 8) ઉમેદવારે વાંધા અરજીમાં પોતાનો વાંધો સ્પષ્ટ રીતે રજુ કરવાનો રહેશે તથા વાંધા અન્વયે આનુસંગીક આધારોની અસલ તથા સ્વપ્રમાણિત નકલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટર પર ફરજિયાતપણે રજુ કરવાની રહેશે.
- 9) મહિલા વિધવા ઉમેદવારે મહિલા વિધવા અનામતનો લાભ લેવા માટે, વાંધા અરજી રજુ કરવી તથા વાંધા અરજી સાથે સક્ષમ અધિકારી તરફથી મેળવેલ વિધવા પ્રમાણપત્ર અચૂક રજુ કરવાનું રહેશે.
- 10) સૂચવેલ સ્થળે અને સમયે રજુ ન થયેલ વાંધા તેમજ સદર કચેરીને ટપાલ, કુરીયર કે રજી. એ.ડી. કે ઈ-મેઈલ મારફતે મળેલ અરજીઓ દફતરે કરવામાં આવશે.
- 11) ઉમેદવારોએ COVID-19 મહામારી અંગે સરકારશ્રી દ્વારા અપાયેલ વખતોવખતની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
- 12) વાંધા અરજીઓ જે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટર પર ઉમેદવારે રૂબરૂમાં અરજી કરવાની રહેશે. તેમ છતાં જો ઉમેદવાર COVID-19 પોઝીટીવ હોય/ક્વોરન્ટાઈન/કન્ટેન્ટમેન્ટ ઝોનમાં હોય તો ઉમેદવારે સૂચવેલ સમયે અને સ્થળે તમામ આનુસંગીક આધારો સહ અન્ય કોઈ વ્યક્તિને પોતનો ઓથોરીટી લેટર આપી મોકલી શકશે.